

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY
DIPLOMA ENGINEERING – SEMESTER- 2(new) EXAMINATION –Winter- 2019

Subject Code: 3320002**Date: 24-12-2019****Subject Name: ADVANCED MATHEMATICS (GROUP-1)****Time: 02:30 PM TO 05:00 PM****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of only simple calculator is permitted in Mathematics.
6. English version is authentic.

Q.1

Fill in the blanks using appropriate choice from the given options.

14

- 1 If $Z = \sqrt{3} - i$ then $\bar{Z} = \underline{\hspace{2cm}}$.

a. $-\sqrt{3} - i$	b. $\sqrt{3} + i$	c. $-\sqrt{3} + i$	d. $\frac{1}{\sqrt{3}-i}$
--------------------	-------------------	--------------------	---------------------------
- 2 यदि $Z = \sqrt{3} - i$ तो $\bar{Z} = \underline{\hspace{2cm}}$.

અ. $-\sqrt{3} - i$	બ. $\sqrt{3} + i$	ક. $-\sqrt{3} + i$	ડ. $\frac{1}{\sqrt{3}-i}$
--------------------	-------------------	--------------------	---------------------------
- 2 Inverse of the complex number $i = \underline{\hspace{2cm}}$.

a. i	b. $-i$	c. 1	d. -1
--------	---------	--------	---------
- 2 સંકર સંખ્યા i માટે વ્યસ્ત સંકર સંખ્યા $\underline{\hspace{2cm}}$ થશે.

અ. i	બ. $-i$	ક. 1	ડ. -1
--------	---------	--------	---------
- 3 If $Z^2 = -i$ then $Z = \underline{\hspace{2cm}}$.

a. $\frac{1}{\sqrt{2}}(1+i)$	b. $\pm \frac{1}{\sqrt{2}}(1+i)$	c. $\pm \frac{1}{\sqrt{2}}(1-i)$	d. $\frac{1}{\sqrt{2}}(1-i)$
------------------------------	----------------------------------	----------------------------------	------------------------------
- 3 યदि $Z^2 = -i$ હોય તો $Z = \underline{\hspace{2cm}}$.

અ. $\frac{1}{\sqrt{2}}(1+i)$	બ. $\pm \frac{1}{\sqrt{2}}(1+i)$	ક. $\pm \frac{1}{\sqrt{2}}(1-i)$	ડ. $\frac{1}{\sqrt{2}}(1-i)$
------------------------------	----------------------------------	----------------------------------	------------------------------
- 4 If $Z = \cos \theta + i \sin \theta$ then $Z^3 + \frac{1}{Z^3} = \underline{\hspace{2cm}}$.

a. $2 \cos 3\theta$	b. $2 \sin 3\theta$	c. $2i \cos 3\theta$	d. $2i \sin 3\theta$
---------------------	---------------------	----------------------	----------------------
- 4 યदि $Z = \cos \theta + i \sin \theta$ હોય તો $Z^3 + \frac{1}{Z^3} = \underline{\hspace{2cm}}$.

અ. $2 \cos 3\theta$	બ. $2 \sin 3\theta$	ક. $2i \cos 3\theta$	ડ. $2i \sin 3\theta$
---------------------	---------------------	----------------------	----------------------
- 5 If $f(x) = \log(\tan x)$ then $f\left(\frac{\pi}{4}\right) = \underline{\hspace{2cm}}$.

a. 1	b. e	c. 0	d. π
------	------	------	----------
- 5 યदि $f(x) = \log(\tan x)$ હોય તો $f\left(\frac{\pi}{4}\right) = \underline{\hspace{2cm}}$.

અ. 1	બ. e	ક. 0	ડ. π
------	------	------	----------
- 6 $\lim_{n \rightarrow 0} \left(\frac{e^x - 1}{x} \right) = \underline{\hspace{2cm}}$.

a. 0	b. e	c. 1	d. -1
------	------	------	-------
- 6 $\lim_{n \rightarrow 0} \left(\frac{e^x - 1}{x} \right) = \underline{\hspace{2cm}}$.

અ. 0	બ. e	ક. 1	ડ. -1
------	------	------	-------

7. $\frac{d}{dx}(\cos^2 x) = \underline{\hspace{2cm}}$.
 a. $2 \cos x$ b. $\sin 2x$ c. $-\sin 2x$ d. $\cos 2x$
9. $\frac{d}{dx}(\cos^2 x) = \underline{\hspace{2cm}}.$
 અ. $2 \cos x$ બિ. $\sin 2x$ ક્ર. $-\sin 2x$ દિ. $\cos 2x$
8. $\frac{d}{dx}(u \cdot v) = \underline{\hspace{2cm}}.$
 અ. $\frac{du}{dx} \times \frac{dv}{dx}$ બિ. $\frac{du}{dx} + \frac{dv}{dx}$ ક્ર. $u \frac{dv}{dx} + v \frac{du}{dx}$ દિ. $u \frac{dv}{dx} - v \frac{du}{dx}$
૯. $\frac{d}{dx}(u \cdot v) = \underline{\hspace{2cm}}.$
 અ. $\frac{du}{dx} \times \frac{dv}{dx}$ બિ. $\frac{du}{dx} + \frac{dv}{dx}$ ક્ર. $u \frac{dv}{dx} + v \frac{du}{dx}$ દિ. $u \frac{dv}{dx} - v \frac{du}{dx}$
૧૦. If $y = \log \sin x$ then $\frac{dy}{dx} = \underline{\hspace{2cm}}.$
 અ. $\tan x$ બિ. $\cot x$ ક્ર. $-\tan x$ દિ. $-\cot x$
૧૧. જે $y = \log \sin x$ હોય તો $\frac{dy}{dx} = \underline{\hspace{2cm}}.$
 અ. $\tan x$ બિ. $\cot x$ ક્ર. $-\tan x$ દિ. $-\cot x$
૧૦. જે $f(x) = e^{3x}$ હોય તો $f'(0) = \underline{\hspace{2cm}}.$
 અ. $3e$ બિ. 3 ક્ર. 1 દિ. 0
૧૧. જે $f(x) = e^{3x}$ હોય તો $f'(0) = \underline{\hspace{2cm}}.$
 અ. $3e$ બિ. 3 ક્ર. 1 દિ. 0
૧૨. $\int \frac{1}{x} dx = \underline{\hspace{2cm}} + c.$
 અ. x^{-1} બિ. x^{-2} ક્ર. $-x^{-2}$ દિ. $\log|x|$
૧૩. $\int \frac{1}{x} dx = \underline{\hspace{2cm}} + c.$
 અ. x^{-1} બિ. x^{-2} ક્ર. $-x^{-2}$ દિ. $\log|x|$
૧૪. $\int_0^1 \frac{dx}{1+x^2} = \underline{\hspace{2cm}} + c.$
 અ. $\pi/2$ બિ. $\pi/3$ ક્ર. $\pi/6$ દિ. $\pi/4$
૧૫. $\int_0^1 \frac{dx}{1+x^2} = \underline{\hspace{2cm}} + c.$
 અ. $\pi/2$ બિ. $\pi/3$ ક્ર. $\pi/6$ દિ. $\pi/4$
૧૬. For the differential equation $\frac{dy}{dx} + Py = Q$, Integrating Factor = ____.
 અ. $e^{\int P dx}$ બિ. $e^{-\int P dx}$ ક્ર. $e^{\int Q dx}$ દિ. none of these.
૧૭. વિકલ સમીકરણ $\frac{dy}{dx} + Py = Q$ માટે, સંકલ્યકારક અવયવ = ____ હૈ.
 અ. $e^{\int P dx}$ બિ. $e^{-\int P dx}$ ક્ર. $e^{\int Q dx}$ દિ. એકપણ નહીં
૧૮. The order and degree of the equation $\left(\frac{d^3y}{dx^3}\right)^4 + \left(\frac{d^4y}{dx^4}\right)^2 + y = 0$ are ____.
 અ. 4 and 2 બિ. 2 and 4 ક્ર. 3 and 4 દિ. 4 and 3
૧૯. વિકલ સમીકરણ $\left(\frac{d^3y}{dx^3}\right)^4 + \left(\frac{d^4y}{dx^4}\right)^2 + y = 0$ માટે કક્ષા અને પરિમાણ ____
 અ. 4 અને 2 બિ. 2 અને 4 ક્ર. 3 અને 4 દિ. 4 અને 3

- Q.2 (a) Attempt any two કોઈપણ બે ના જવાબ આપો.
 1. Find $x, y \in R$ from the equation

$$(2x - y) + 2yi = 6 + 4i$$

1. સમીકરણ $(2x - y) + 2yi = 6 + 4i$ માંથી $x, y \in R$ શોધો.
2. Express the complex number $\frac{1+7i}{(2-i)^2}$ in the form of $x+iy, x, y \in R$.
2. સંકર સંખ્યા $\frac{1+7i}{(2-i)^2} x+iy$ ના સ્વરૂપ માં દર્શાવો $x, y \in R$
3. Express the following complex number in polar form also find modulus and principal argument $-1 + \sqrt{3}i$
3. સંકર સંખ્યા $-1 + \sqrt{3}i$ ધૂવીય સ્વરૂપ માં દર્શાવો તેમજ માનાંક તથા મુખ્ય કોણાંક શોધો.
- (b)** Attempt any two કોઈપણ બે ના જવાબ આપો. 08
1. If $f(x) = \frac{1-x}{1+x}$ then prove that
- (i) $f(x) + f\left(\frac{1}{x}\right) = 0$ (ii) $f(x).f(-x) = 2f(x)$
1. જો $f(x) = \frac{1-x}{1+x}$ હોય તો સાબિત કરો કે
- (i) $f(x) + f\left(\frac{1}{x}\right) = 0$ (ii) $f(x).f(-x) = 2f(x)$
2. Evaluate : $\lim_{x \rightarrow 1} \frac{x^2 - 6x + 5}{2x^2 - 5x + 3}$
2. કીમત શોધો : $\lim_{x \rightarrow 1} \frac{x^2 - 6x + 5}{2x^2 - 5x + 3}$
3. Evaluate : $\lim_{x \rightarrow 0} \left(1 + \frac{3x}{2}\right)^{\frac{4}{x}}$
3. કીમત શોધો : $\lim_{x \rightarrow 0} \left(1 + \frac{3x}{2}\right)^{\frac{4}{x}}$
- Q.3** **(a)** Attempt any two કોઈપણ બે ના જવાબ આપો. 06
1. Find derivative of $f(x) = 2x \sin x - x^3 \cos x$
1. $f(x) = 2x \sin x - x^3 \cos x$ નું વિકલિત શોધો.
2. if $y = \log(e^{\sin x})$ then prove that $\frac{dy}{dx} - \cos x = 0$
2. જો $y = \log(e^{\sin x})$ તો સાબિત કરો કે $\frac{dy}{dx} - \cos x = 0$
3. Find $\frac{dy}{dx}$ from the equation $x \sin y + y \sin x = 0$
- સમીકરણ $x \sin y + y \sin x = 0$ માંથી $\frac{dy}{dx}$ શોધો.

(b) Attempt any two કોઈપણ બે ના જવાબ આપો.

08

1. If $y = e^{m \tan^{-1} x}$, then prove that. $(1 + x^2) \frac{d^2y}{dx^2} + (2x - m) \frac{dy}{dx} = 0$

q.

જો $y = e^{m \tan^{-1} x}$, હોય તો સાંભિત કરો કે $(1 + x^2) \frac{d^2y}{dx^2} + (2x - m) \frac{dy}{dx} = 0$

2. The equation of motion of a particle is $s = t^3 + 3t$. Find the acceleration and distance travelled by the particle when the velocity is 9 cm/sec.
2. એકકણ માટે ગતિ નું સમીકરણ $s = t^3 + 3t$ છે. જયારેવેગા 9 cm/sec. ત્યારે પ્રવેગ શોધો અને એ સમયે કણ દ્વારા કાપેલું અંતર પણ શોધો.
3. Find Maximum and minimum values of the function $Y = 2x^3 - 3x^2 - 12x + 5$.
3. વિધેય, $Y = 2x^3 - 3x^2 - 12x + 5$ માટે મહત્વમન્ત્રાનું ન્યુનતમ કીમતો મેળવો.

Q.4 (a) Attempt any two કોઈપણ બે ના જવાબ આપો.

06

1. Evaluate: $\int \left(\sqrt{x} + \frac{1}{\sqrt{x}} \right)^2 dx$

q. કીમત શોધો : $\int \left(\sqrt{x} + \frac{1}{\sqrt{x}} \right)^2 dx$

2. Evaluate : $\int \frac{\sin^3 x + \cos^3 x}{\sin^2 x \cdot \cos^2 x} dx$

2. કીમત શોધો : $\int \frac{\sin^3 x + \cos^3 x}{\sin^2 x \cdot \cos^2 x} dx$

3. Evaluate $\int e^{\sin x} \cdot \cos x dx$

3. કીમત શોધો : $\int e^{\sin x} \cdot \cos x dx$

(b) Attempt any two કોઈપણ બે ના જવાબ આપો.

08

1. Evaluate : $\int_0^1 x \tan^{-1} x dx$

q. કીમત શોધો : $\int_0^1 x \tan^{-1} x dx$

2. Evaluate : $\int_0^{\frac{\pi}{2}} \frac{\sqrt{\sin x}}{\sqrt{\cos x} + \sqrt{\sin x}} dx$

2. કીમત શોધો : $\int_0^{\frac{\pi}{2}} \frac{\sqrt{\sin x}}{\sqrt{\cos x} + \sqrt{\sin x}} dx$

3. Find area bounded by the curve $y^2 = 4x$ and the line $x = 2$.

3. ક્રિક્યુલેશન કરો કે $y^2 = 4x$ અને રેખા $x = 2$ થી સીમિત પ્રાંતનું ક્ષેત્રફળ શોધો..

Q.5 (a) Attempt any two કોઈપણ બે ના જવાબ આપો.

06

1. Evaluate : $\lim_{x \rightarrow 0} \frac{2 \sin x - \sin 2x}{x^3}$

2. ફીમત શોધો : $\lim_{x \rightarrow 0} \frac{2 \sin x - \sin 2x}{x^3}$

2. Solve the differential equation : $x(1 + y^2)dx = y(1 + x^2)dy$

2. વિકલ સમીકરણ ઉકેલો : $x(1 + y^2)dx = y(1 + x^2)dy$.

3. Solve , $\frac{dy}{dx} + y \tan x = \cos x$

3. ઉકેલો : , $\frac{dy}{dx} + y \tan x = \cos x$

(b) Attempt any two કોઈપણ બે ના જવાબ આપો.

08

1. Solve the differential equation: $\frac{dy}{dx} = \frac{y}{x} + \sin \frac{y}{x}$

2. વિકલ સમીકરણ ઉકેલો : $\frac{dy}{dx} = \frac{y}{x} + \sin \frac{y}{x}$

2. solve : $(1 + x^2) \frac{dy}{dx} + y = \tan^{-1} x$

2. ઉકેલો : $(1 + x^2) \frac{dy}{dx} + y = \tan^{-1} x$

3. solve : $(x^2 + y^2)dx = 2xy dy$

3. ઉકેલો : $(x^2 + y^2)dx = 2xy dy$
